

## પહેલો છું સિપાહી, પછી શાહ

— જ્યલ્લિખ્યુ

હુસેનખાં નામનો એક જમીનદાર. બંગાળમાં રહે.

અને ફરીદ નામનો દીકરો.

ફરીદ નાનપણથી હોશિયાર. જોનપુરની નિશાળમાં ભણે. એ વખતે નિશાળમાં ત્રણ જાતનું ભાણતર મળે; એક હથિયારનું, બીજું ધર્મનું અને ત્રીજું વ્યવહારનું.

ફરીદ ત્રણેમાં હોશિયાર.

આઈ વર્ષની ઉભરે એ બંગાળના નવાબ પાસે ગયો અને નોકરી માગી. નવાબે છોકરાની પરીક્ષા લીધી. છોકરાએ એવા એવા જવાબ આપ્યા કે નવાબ ખુશ ખુશ થઈ ગયો.

ફરીદ તીર-તલવાર લઈ રોજ જંગલમાં ફરવા જાય. એ વખતે વાધનો જબરો ત્રાસ. એના કારણે ગામનાં ગામ ઉજ્જવલ થઈ ગયેલાં. ઘણી મહેનત કરે, પણ હાથમાં આવે જ નહીં. માણસ મારીને સંતાઈ જાય, પત્તો જ ન મળે.

ફરીદ કહે : “વાધદાદાની મારે ખબર લેવી છે.”

લોકો કહે : “ભાઈ, છોકરાંથી છાશ ન પીવાય.”



ફરીદ કહે : “હું તો દૂધ પીનારો છું. વાઘદાદા મળે તો ભૂપીતા ન કરું તો મારું નામ ફરીદ નહીં.”

બનવા કાળ હશે. બરાબર બનેનો બેઠો થઈ ગયો. એક તરફ સોળ—અઢાર વર્ષનો છોકરો ! બીજુ તરફ જમાનાના ખાદેલ વાઘદાદા !

બંને આવ્યા બાથમૂં બાથા ! ગડદમૂં ગડદા ! પાટમૂં પાટા ! ખરી ઝપાઝપી ચાલી. બંને જણા ખૂબ ઘાયલ થયા.

આખરે બંને જણા ઢળી પડ્યા, એમાં વાઘદાદા તરત મરી ગયા. ફરીદ થોડી વારે બેઠો થયો.

લોકોએ ફરીદની વાહવાહ કરી. બંગાળના નવાબે એને શેરખાંની પદવી આપી. શેર એટલે વાધ. બંગાળમાં સિંહ થતા નથી. સિંહ એકલા ગીરમાં થાય છે.

ફરીદ શેરખાં બન્યો. એ હવે લશ્કરમાં જોડાયો. એ વખતે મોગલ બાદશાહ બાબર ભારતને જીતતો હતો. શેરખાંએ જોયું કે આ બધા માત્ર લડી જાણો છે, દીવાનના નચાવ્યા નાચે છે, રૈયતની સંભાળ રાખતા નથી, રૈયત એમને ચાહતી નથી. હું પ્રજાને ચાહું, પ્રજાની સંભાળ લઉં, લશ્કર એકહું કરું, મારી મતિથી કામ કરું, તો હું પણ રાજી થઈ શકું.

શેરખાંએ લશ્કર જમાવ્યું. ઉપરાઉપરી જીત મેળવવા લાગ્યો. એવામાં મોગલ બાદશાહ બાબર ટૂંકી માંદગીમાં ગુજરી ગયા. હુમાયું હિંદનો બાદશાહ થયો.

શેરખાંએ હુમાયું સામે લડાઈ જમાવી. હુમાયું પાસે મોહું લશ્કર, મોટી તોપો; શેરખાં પાસે કંઈ નહીં, છતાં હુમાયુને એવો હેરાન કર્યો કે વાત નહીં.

માંડ માંડ જીવનો જતો બચ્યો.

શેરખાં હવે રાજનો માલિક બન્યો. ધીરે ધીરે હિંદુસ્તાનનો માલિક બન્યો.

શેરશાહ નામ ધારણ કરી દિલહીની ગાદીએ બેઠો. પોતાના નામના સિક્કા પાડ્યા. દેશભરમાં સારો બંદોબસ્ત કર્યો.

એક વાર મોગલોનો દૂત એને મળવા આવ્યો. શેરશાહ મહેલમાં હતો. દૂતને ત્યાં લઈ ગયા.

મહેલમાં એક ભૌંયરું ખોદાતું હતું. કેટલાય મજૂરો કામે લાગ્યા હતા.

એક મજૂર મોગલ દૂત પાસે આવ્યો. મજૂરના હાથમાં પાવડો હતો. એણે કહું,

“બોલો, તમે કોણ છો ?”

મોગલ દૂતે કહું, “હું મોગલોનો દૂત છું. મારે બાદશાહ શેરશાહને મળવું છે.”

મજૂરે ધૂળવાળા હાથ ખંખેર્યા ને કહ્યું, “હું શેરશાહ છું.”

મોગલ દૂત અજાયબ થઈ ગયો. એણે કહ્યું, “મારા માન્યામાં આવતું નથી. તમે પોતે શહેનશાહ છો ?”

“હા, હું પોતે શહેનશાહ છું. હું પહેલો સિપાઈ છું, પછી શહેનશાહ છું.”

મજૂરની હાલતમાં શેરશાહે મોગલ દૂત સાથે વાતો કરી. મોગલ દૂત પોતાની છાવણીમાં પાછો ફ્યો. એણે કહ્યું, “આવા કર્તવ્યપરાયણ માણસને કોણ જીતી શકવાના છે ? મોટા થયા એટલે મોજશોખ કરવા, એમ માનનારા કદી એને હરાવી નહીં શકે.”

શેરશાહ ભારતનો મહાન બાદશાહ થયો. એણે પ્રજાને સુખી કરી. રસ્તા છાંયાવાળા કર્યા. ટપાલ શરૂ કરી. ધર્મશાળાઓ બાંધી. કૂવા ખોદાવ્યા.

કહેવાય છે કે, એના રાજમાં ઘરડી ઠોશી સવારોર સોના સાથે અડધી રાતે મુસાફરી કરી શકતી.

